

રાજકોટ મહાનગરપાલિકા

ડો. આંબેડકર ભવન, હેબરભાઈ રોડ, રાજકોટ-૩૬૦ ૦૦૧

-: અખબારી યાદી:-

તા. ૧૬-૦૩-૨૦૨૦ ના રોજ શહેરના વિવિધ રાજમાર્ગો પર અનાધિકૃત દબાણો હટાવવા: રૂ.૩૧,૧૭૫/- નો વહીવટી ચાર્જ વસુલ

વોર્ડ ઓફિસર, પોલીસ અને દબાણ હટાવ શાખાની વોર્ડ વાઈઝ ટીમો દ્વારા ઝુંબેશના રૂપમાં કામગીરી

તારીખ: ૧૭-૦૩-૨૦૨૦

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જાહેર માર્ગો પરથી અનાધિકૃત દબાણો હટાવવા માટે રાજકોટ શહેર પોલીસ સાથે સંકલન કરી વોર્ડ ઓફિસર, પોલીસ અને દબાણ હટાવ શાખાના સ્ટાફની બનેલી વોર્ડ વાઈઝ ટીમોની રચના કરવામાં આવેલી છે. આ દબાણ હટાવ ટીમ દ્વારા થઈ રહેલી કામગીરીની વિગતો મુજબ તારીખ: ૧૬-૦૩-૨૦૨૦ ના રોજ ઈસ્ટ ઝોનની ત્રણેય ટીમો દ્વારા કુલ ૦૧ નંગ પરચુરણ માલસામાન અને શાકભાજી/ફળ/કુલ વગેરેનો કુલ ૩૫ કિ.ગ્રા જથ્થો જપ્ત કરેલ છે, તેમજ રૂ. ૩,૦૦૦/- વહિવટી ચાર્જ(વિપુલભાઈ, રમેશભાઈ, દેવરાજભાઈ, બાબુભાઈ, અને રાવિતભાઈ વગેરેનો) વસુલ કરેલ છે. સેન્ટ્રલ ઝોનની ત્રણેય ટીમો દ્વારા કુલ ૦૩ રેકડી(સલીમભાઈ, પ્રકાશ હરેશભાઈ) જપ્ત કરેલ છે, અને વિવિધ પ્રકારના ૩૪ નંગ પરચુરણ માલ-સામાન(આશિષભાઈ, રાકેશભાઈ, સંતોષભાઈ અને અન્ય અનામી વગેરેનો) જપ્ત કરેલ છે, આ ઉપરાંત શાકભાજી/ફળ/કુલ વગેરેનો કુલ ૧૫૫ કિ.ગ્રા જથ્થો જપ્ત કરેલ છે, તેમજ રૂ.૧૦,૫૦૦/- વહિવટી ચાર્જ(પ્રતાપભાઈ, પ્રિયેશભાઈ, ભરતભાઈ, ખોડાભાઈ, દુધાભાઈ, મયુરભાઈ, મહેબુબભાઈ, અને મનીરાજભાઈ વગેરેનો) વસુલ કરેલ છે. વેસ્ટ ઝોનની ત્રણેય ટીમો દ્વારા ૦૧ રેકડી/કેબીન(વિનોદભાઈ) અને વિવિધ પ્રકારના ૦૬ નંગ પરચુરણ માલ-સામાન(સદગુરુ કુડ ઝોન, અને અન્ય અનામી) જપ્ત કરેલ છે, આ ઉપરાંત કુલ રૂ.૧૨,૧૭૫/- મંડપ/છાજલી ચાર્જ(હરભોલે ફરસાણ, ગીર રસ સેન્ટર, યોગી ફરસાણ, અને ધર્મોદ્ભભાઈ વગેરેનો) વસુલ કરેલ છે તેમજ રૂ. ૫,૫૦૦/- વહિવટી ચાર્જ(રાધે હોટલ, દિનેશભાઈ, ભરતભાઈ, ચેતનભાઈ, અજયભાઈ, અને મનીષભાઈ વગેરેનો) વસુલ કરેલ છે, તેમ મ્યુનિ. કમિશનરશ્રી ઉદ્દિત અગ્રવાલે જણાવ્યું છે.

(જન સંપર્ક અધિકારી)

રાજકોટ મહાનગરપાલિકા